

સુસ્વાગતમ્

ડબ્લિનમાં સ્વાગત છે

ડબ્લિન શહેરના વતી, જ્યારે તમે ડબ્લિનમાં તમારું નવું ઘર બનાવશો ત્યારે અમે તમારા અને તમારા પરિવાર માટે ભાવભર્યું સ્વાગત કરીશું.

ડબ્લિનમાં ઉચ્ચ ગુણવત્તાનું જીવન પૂરી પાડવા માટે અમે સમર્પિત છીએ. આ તાજેતરના [રાષ્ટ્રીય નાગરિક સર્વેમાં](#) પ્રતિબિંબિત થાય છે, જેમાં અમારા 99 ટકા રહેવાસીઓએ ડબ્લિનને રહેવા માટે એક ઉત્તમ અથવા સારી જગ્યા તરીકે સ્થાન આપ્યું છે. સુંદર આસપડોશ, બગીચાઓ અને હરિયાળી જગ્યાઓના કારણે તમે કદાચ ડબ્લિનને તમારા ઘર તરીકે પસંદ કર્યું છે. [અહીંયા આવવા](#) દ્વારા અમારા સુંદર સમુદાયને જાળવવામાં અમારી સહાય કરવા માટે, તમારે શું જાણવાની જરૂર છે, તે જાણો.

સરકારમાં પારદર્શિતા માટે શહેર પ્રતિબદ્ધ રહે છે અને ઘણી બધી રીતે છે એના દ્વારા તમે વ્યસ્ત થઈ શકો છો અને જાણ કરી શકો છો. શહેરની સેવાઓ, શહેરના નેતૃત્વના પરિચય અને કાર્યક્રમોના કેલેન્ડર વિશે વધુ માહિતી માટે અમારી વેબસાઇટ બ્રાઉઝ કરો.

પ્રવૃત્તિઓ ભરપૂર છે – [ડબ્લિન કમ્યુનિટી રિક્રિએશન સેન્ટર](#)માં ફિટનેસ અને મનોરંજનની તકોમાંથી પસંદગી કરો, અમારા સ્વતંત્રતા દિવસની ઉજવણી અને ડબ્લિન આઇરિશ ફેસ્ટિવલ જેવા [સામુદાયિક કાર્યક્રમો](#)નો આનંદ માણો, અને અમારી 100+-માઇલ [બાઇક પાથ સિસ્ટમ](#) અને [60 જાહેર ઉદ્યાનો](#) (પબ્લિક પાર્ક્સ)નું અન્વેષણ કરો. આ ઉપરાંત, અમારા સશક્ત [વૉલંટિયર પ્રોગ્રામ](#) (સ્વયંસેવક કાર્યક્રમ) અમારા સમુદાયમાં જોડાવા માટે તમામ ઉંમરના લોકો માટે વિકલ્પો પ્રદાન કરે છે.

જ્યારે કુટુંબ અને મિત્રો મુલાકાત લે છે, અથવા જો તમે સૂચનો શોધી રહ્યા છો, ત્યારે ડબ્લિન કન્વેન્શન અને વિઝિટર્સ બ્યુરો વેબસાઇટ visitdublinohio.comની મુલાકાત લો અથવા ઐતિહાસિક ડબ્લિનમાં વિઝિટર સેન્ટર પર રોકાઓ. જ્યારે તમે સંસ્કૃતિ માટેની ઈચ્છા ધરાવો છો, ત્યારે [ડબ્લિન આર્ટ્સ કાઉન્સિલ](#) તમારું મુકામ રહે છે જ્યાં બગીચાઓમાં ખુલ્લાં કોન્સર્ટ, ગેલરી પ્રદર્શન અને રચનાત્મક ક્લાસનો સમાવેશ થાય છે.

અમે તમને ડબ્લિન શહેરની ઓફર કરવાની બધી સેવાઓ અને સુવિધાઓથી પરિચિત થવા અને લાભ લેવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ. તમારા પોતાના શહેરમાં સ્વાગત છે!

અંત:કરણપૂર્વક,

મેયર ગ્રેગ પીટરસન

ડાના મેકડેનિયલ, સિટી મેનેજર